

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૬/૨૦૧૭ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૨૫૫/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૩ કેસ કરી ૪૦ વ્યક્તિઓને ઝડપી, ૧૨૦ લીટર દેશી દારૂ, ૧૯ બોટલ ઈંગ્લીશ દારૂ, ૬૯ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૩૫ બિયર ટીન અને ૨ સ્ફૂટર કબજે કર્યા હતા. તેમજ જુગારધારા હેઠળ ૩ કેસ કરી, ૧૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૫,૧૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૨૫૬/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૩૭૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૨૦ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

છેતરપિંડી:-

સમાચાર યાદી નં.૧૨૫૭/૧૭

કાગડાપીઠ: અનુજભાઈ રોહીતભાઈ મહેતા (રહે. નંદવન બંજોઝ કર્ણાવતી કલબની પાસે સરખેજ ગાંધીનગર હાઇવે) એ તા.૧૭/૬/૧૭ નારોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી છે તા.૨૦/૬/૧૬ થી તા.૭/૬/૧૭ સુધીના સમયગાળા દરમિયાન કાંકરીયા ઇકા કલબ સ્ટ્રાન્સસ્ટેડીયા પ્રા.લી કંપની ખાતે આરોપી કરણ પ્રભુ દેવસિંગ સંઘુ (રહે. આર્મની હાઉસ સોલા ભાગવત ટેમ્પલ, સોલા) એ ખોટી સહી કરી તેમજ ઇકા કલબના લેટરપેડનો ઉપયોગ કરી અનુજભાઈ મહેતા તેમજ સાહેદો પાસેથી રૂપિયા ૪૮,૦૦૦/- અને ૪૮,૦૦૦/- ના ચેક મેળવી છેતરપિંડી કરી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એસ.એસ.મોદી ચલાવે છે.

થેલો ઝુંટવી લઈ ગયા:-

સમાચાર યાદી નં.૧૨૫૮/૧૭

બાપુનગર: જીતેન્દ્રભાઈ જેઠાલાલ પટેલ (ઉ.વ.૫૩) (રહે. કીશ ગોલ્ડ ન્યુ ઇન્ડિયા કોલોની નવા ડીમાર્ટની પાછળ નીકોલ) તા.૧૭/૬/૧૭ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે અનિલસ્ટાર્ચ રોડ શ્યામ શીખર પાસે પંજાબ નેશનલ બેંક નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ જીતેન્દ્રભાઈ પટેલના હાથમાંથી થેલો ઝુંટવી લઈ નાસી ગયા હતા જે થેલામાં રોકડ રૂપિયા ૮૦,૦૦૦/- મતા હતી. આ અંગેની ફરીયાદ જીતેન્દ્રભાઈ પટેલે બાપુનગર પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.ઈ.શ્રી એસ.એ.પટેલ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અમદાવાદ શહેર.
પોલીસ કમિશનર વતી.